



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા૩૦/૦૭/૨૦૧૯ મંગળવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૨૭૮/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૩૮ કેસ કરી, ૩૨ વ્યક્તિઓને ઝડપી, ૧૧૧ લીટર દેશી દારૂ, ૩૨૬ બોટલ ઈંગ્લીશ દારૂ, ૭૭૬ બિયર ટીન અને ૧ મોટર સાયકલ કબજે કર્યું હતું. તેમજ જુગાર ધારા હેઠળ ૨ કેસ કરી, ૧૩ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૧૬,૦૪૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૨૭૯/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૩૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પાસા હેઠળ ૧ વ્યક્તિની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપિંડી :-

સમાચાર યાદી નં.૧૨૮૦/૧૯

સોલા હાઇકોર્ટ: કેતનભાઈ વિનોદરાય વ્યાસ (ઉ.વ.૪૭)(રહે.આઇ.સી.આઇસ લેન્ડ વંદે માતરમ સીટી પાસે, ચાંદલોડીયા, ગોતા) એ તા.૨૯/૦૭/૧૯ ના રોજ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૨/૦૨/૧૯ થી આજદીન સુધીના સમયગાળા દરમ્યાન આરોપી નિખીલ પારીખ ઉર્ફે નિરજ શર્મા (જેના પુરા નામ-સરનામાની ખબર નથી) એ કેતનભાઈને ફોન કરી નોકરી આપવા બાબતે મેમ્બરશીપ કરવા માટેની વાત કરી, કેતનભાઈ પાસેથી અલગ-અલગ એકાઉન્ટમાં ઓનલાઇન ટ્રાન્ઝેક્શન દ્વારા રૂપિયા ૧૨,૦૦,૦૦૦/- મેળવી લઈ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી જે.ડી પટેલ ચલાવે છે.

પોલીસની ખોટી ઓળખ આપી કઢાવી લેવા બાબત:-

સમાચાર યાદી નં.૧૨૮૧/૧૯

કાગડાપીઠ: કશીશભાઈ છગનભાઈ કોષ્ટી (ઉ.વ.૩૧)(રહે.કોષ્ટી સોસાયટી જૈન હાઇસ્કૂલ પાસે મણિનગર) એ કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૯/૦૭/૧૯ કલાક ૧૧/૩૦ થી કલાક ૧૨/૪૫ વાગ્યા સુધીના સમયગાળા દરમ્યાન બે અજાણ્યા પુરૂષોએ કાઠમ બ્રાન્ય પોલીસની ખોટી ઓળખ આપી શ્રેયસ ચાર રસ્તાથી કશીશભાઈને ગાડીમા બેસાડી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી કાશીરામ ટેક્સટાઇલ્સની સામેની સાઇડમા આવેલ ટાટા ઇન્ડીકેસ એ.ટી.એમ.પાસે લઈ જઈ, કશીશભાઈનો એ.ટી.એમ. કાર્ડનો નંબર પુછી એ.ટી.એમ.કાર્ડ દ્વારા બળજબરીથી કુલ રૂપિયા ૪૦,૦૦૦/- કઢાવી લઈ, કશીશભાઈને નારોલ સર્કલ પુલ નીચે ઉતારી નાસી ગયા હતા. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.બી.પટેલ ચલાવે છે.

ઘરફોડ:-

સમાચાર યાદી નં.૧૨૮૨/૧૯

વેજલપુર: પ્રતાપભાઈ ગલબાજી ખટીક (રહે.રજનીગંધા ફ્લેટ વેજલપુર) એ વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૯/૦૭/૧૯ કલાક ૧૧/૪૫ થી ૧૨/૪૫ વાગ્યા દરમ્યાન પોતાના મકાનના દરવાજાનું તાળુ તોડી, અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી, સોનાના દાગીના અને રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા ૩૭,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી ડી.બી.લાખણોત્રા ચલાવે છે.

વાહન ચોરી:-

સમાચાર યાદી નં.૧૨૮૩/૧૯

નારણપુરા: અશોકકુમાર ગોવિંદભાઈ પટેલ (રહે.ભરતમીલાપ સોસાયટી, સંઘવી સ્કુલ પાસે નારણપુરા) એ તા.૨૭/૭/૧૯ રાતના ૧૦/૦૦ વાગે રહેણાંક નજીક પોતાની ઇકો ગાડી નંબર જીજે.૦૧.એચટી.૧૨૬૯ કિમત રૂપિયા ૪,૦૦,૦૦૦/- પાર્ક કરી હતી. જેની ચોરી તા.૨૮/૭/૧૯ સવારના ૬/૩૦ વાગ્યા દરમ્યાન થઈ હતી. આ અંગેની ફરીયાદ અશોકકુમાર પટેલે નારણપુરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ હે.કો.શ્રી અનીલકુમાર રામઆશરે ચલાવે છે.

અપમૃત્યુ:-

સમાચાર યાદી નં.૧૨૮૪/૧૯

નારોલ: દિપક જનાર્ધન ચૌધરી (ઉ.વ.૨૧)(રહે.કીર્તીકુંજનગર બચુભાઈનો કુવો વટવા) તા.૨૯/૦૭/૧૯ સાજના ૬/૩૦ વાગ્યાના સુમારે શાહવાડી ખાતે આવેલ ગુપ્તા સિન્થેટીક પ્રા.લી. કંપનીમાં જીગર-ડાંઇગ મશીન ઉપર ઓપરેટર તરીકે કામ કરતા હતા ત્યારે મશીનમાં કાપડ સરખું કરવા જતા હાથ કાપડ સાથે વીંટળાઈ જતા, કાપડ સાથે મશીનના રોલમાં પુરે-પુરા આવી જતા, ગંભીર ઇજાઓ થતા, સારવાર માટે તેમને એલ.જી.હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના ડૉ.શ્રી.એ તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે નારોલ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી મોહનસિંહ સવસિંહ ચલાવે છે.

આત્મહત્યા :-

સમાચાર યાદી નં.૧૨૮૫/૧૯

વસ્ત્રાપુર: અનિલભાઈ હસ્તીમલ શાહ (ઉ.વ.૫૧)(રહે. સુમેલ બીઝનેસ પાર્ક-૩, ન્યુ ક્લોથ માર્કેટ સામે સારંગપુર) એ અગમ્ય કારણસર તા.૨૯/૦૭/૧૯ સાજના ૭/૩૦ વાગ્યાના સુમારે વસ્ત્રાપુર ગામ આલ્ફા વન મોલ સામે આમ્રપાલી લેક્ચ્યુ કોમ્પ્લેક્ષ ઉપરથી પડતું મુકી આત્મહત્યા કરી હતી. આ અંગે વસ્ત્રાપુર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી જયંતીભાઈ ચલાવે છે.

જીઆઇડીસી વટવા: સોહનસિંહ જયોતસિંહ ચૌહાણ (ઉ.વ.૫૦)(રહે.વિનોબાભાવેનગર જીઆઇડીસી વટવા) એ અગમ્ય કારણસર તા.૨૯/૦૭/૧૯ સાજના ૪/૩૦ વાગ્યા પહેલા પોતાના ઘરે લોખંડની એંગલ સાથે દુપટ્ટો બાંધી ગળોફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે જી.આઇ.ડી.સી.વટવા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.આર.શેઠ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.